



### સ્ટ્રીટ પાર્કિંગ, રમતગમતના મેદાનો અને શારીરિક અંતર: આપણું શહેર રહેવાસીઓને COVID-19 દરમિયાન બાય-લોઝ (પેટાકાનૂનો) યાદ કરાવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 30, 2020) – સીટી ઓફ બ્રેમ્પટન રહેવાસીઓને આખું વર્ષ બાય-લોઝ (પેટાકાનૂનો) અનુસરવાનું મહત્વ યાદ કરાવે છે. પેટાકાનૂનો એક સાફ અને સુરક્ષિત શહેરને જાળવવા અનિવાર્ય હોય છે, અને દરેક રહેવાસીએ આ ધોરણોનું પાલન કરવામાં ભૂમિકા ભજવવાની હોય છે.

બ્રેમ્પટનવાસીઓને યાદ અપાવવામાં આવે છે કે પીલ રીજીયન હવે તબક્કો 2 માં પહોંચ્યું હોવા છતાં, નિયમનો ન અનુસરનાર લોકોને [બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેઝર્સ બાય-લો](#) હેઠળ દરેક ગુના માટે લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 અથવા ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ (EMCPA) હેઠળ દંડ કરી શકાય છે. જો લોકો પેટાકાનૂનો ના અનુસરે તો તેઓને અન્ય સંબંધિત શહેરી પેટાકાનૂનો હેઠળ પણ દંડ કરવામાં આવે તેવું બની શકે.

#### શહેરમાં સ્ટ્રીટ પાર્કિંગ

કર્મચારીઓ જુલાઈમાં શહેરના [ટ્રાફિક એન્ડ પાર્કિંગ બાય-લો](#) હેઠળ ઉલ્લંઘન સામે અમલબજાવણી ફરીથી શરૂ કરશે જે COVID-19 મહામારીને લીધે હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. સોમવાર, જુલાઈ 6, 2020 નાં રોજ, રાતભર (ઓવરનાઈટ) પાર્કિંગ માટે અમલબજાવણી ફરીથી શરૂ થશે. શહેરના ટ્રાફિક એન્ડ પાર્કિંગ બાય-લો હેઠળ, વાહનો વહેલી સવારે 2 થી 6 વાગ્યા સુધી સ્ટ્રીટ પર પાર્ક કરી શકાતા નથી. સોમવાર, જુલાઈ 20, 2020 થી, ત્રણ કલાકના પાર્કિંગ ઉલ્લંઘનો માટે અમલબજાવણી ફરીથી શરૂ થશે. બાય-લો હેઠળ, વાહનો એક સમયે ત્રણ કલાકથી વધારે સમય માટે સ્ટ્રીટ પર પાર્ક કરી શકાતા નથી.

પાર્કિંગ સંબંધિત બાબતો જાણવા ઓનલાઈન અથવા 311 નંબર પર કોલ કરીને ઉપલબ્ધ માહિતી જાણી શકાય છે. જુલાઈ 6, 2020 પછી સ્ટ્રીટ પર પાર્ક કરવાની જરૂર પડે તેવા વાહનો માટે કરવાની અરજી આ શહેરની [વેબસાઈટ](#) પર ઉપલબ્ધ છે. વૈકલ્પિક રીતે, વાહનોને સાર્ઈડવોક અને સ્ટ્રીટ વચ્ચેના ડ્રાઈવવેની બુલેવોર્ડ જગ્યા પર પાર્ક કરી શકાય છે.

ખાનગી મિલકત પર દેખરેખ રાખવા અને દંડ નોટિસ આપવા જવાબદાર ખાનગી સિક્યુરિટી કંપનીઓ એક્સેસિબલ પાર્કિંગને લગતા ઉલ્લંઘનો લાગુ કરવાનું અને અગ્નિશમન દળના માર્ગ પર અમલબજાવણી ચાલુ રાખવા ઉપરાંત, ખાનગી મિલકત પર પાર્કિંગના ગુનાની અમલબજાવણી પર ફરીથી શરૂ કરશે.

#### પાર્ક્સનો ઉપયોગ

સીટીના પાર્ક્સ (ઉદ્યાનો) હવે ખુલ્યા છે ત્યારે, રહેવાસીઓને યાદ અપાવવામાં આવે છે કે તબક્કો 2 હેઠળ, બધાં રમતગમતના મેદાનો અને રમતને લગતા સાધનો, આઉટડોર ફિટનેસ સાધનો અને પીવાના પાણીની સિસ્ટમ્સ રહેવાસીઓના આરોગ્ય અને સુરક્ષાને સંરક્ષણ આપવા બંધ રહે છે.

**વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું**

રહેવાસીઓએ ઉનાળુ હવામાનનો આનંદ લેવા ઘરની બહાર જવાનું ચાલુ રાખ્યું છે ત્યારે, આ શહેર તેઓને શારીરિક અંતર જાળવવાનું મહત્વ યાદ અપાવે છે. દરેક વ્યક્તિએ પોતાના [સામાજિક વર્તુળ](#) બહારની કોઈપણ વ્યક્તિથી 2.0 મીટરનું અંતર અચૂક જાળવવું રહ્યું. EMCPA હેઠળ દસથી વધારે લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ છે.

દસથી વધારે લોકો ભેગા થવાનું કે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતરના ઉપાયોનું અનુપાલન ન કરતા ધંધાઓની જાણ કરવા, રહેવાસીઓને 311 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.

COVID-19 સામે પ્રતિક્રિયા કરવા સમુદાયને સહાયરૂપ થવામાં સીટીના પ્રયત્નો પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ

જુઓ, [www.brampton.ca/COVID19](http://www.brampton.ca/COVID19) અથવા Twitter, Facebook અને Instagram પર @CityBrampton ને અનુસરો. આ શહેરના બાય-લોઝ પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca](http://www.brampton.ca).

-30-

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)